

GGL/SEC/1336/2024

To,

National Stock Exchange of India Ltd.,
Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G Block,
Bandra Kurla Complex, Bandra (East), Mumbai
• , , ,
Company Code: NSE-GUJGASLTD

Sub: Newspaper Advertisement titled - Notice to the Shareholders for the 12th (Twelfth) Annual General Meeting to be held through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM), E-Mail Id/Mobile No./Bank Mandate Updation/TDS on Dividend **Income and request for Dematerialization of Equity Shares**

Respected Sir/ Madam,

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of the newspaper advertisement published in newspapers - Financial Express - All India Edition (English Language) & Gujarati Edition (Gujarati Language) on 20th August, 2024 regarding Notice to the Shareholders for the 12th (Twelfth) Annual General Meeting to be held through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM), E-Mail Id/Mobile No./Bank Mandate Updation/ TDS on Dividend Income and request for Dematerialization of Equity Shares.

This is for your information and record.

Thanking you,

For, Gujarat Gas Limited

Sandeep Dave **Company Secretary**

Encl: As above

Website: www.gujaratgas.com, www.gspcgroup.com CIN: L40200GJ2012SGC069118

STEEP DROP ATTRIBUTED TO CYCLICAL DOWNTURN

Funding for Al-based startups fall 90% in Q1

PADMINI DHRUVARAJ Bengaluru, August 19

FUNDING FOR AI-BASED startups in both services and infrastructure witnessed a 90% sequential decline in the quarter ended June, according to Tracxn data.

Analysts said the steep drop in investment is attributed to the cyclical downturn in the macroeconomic environment, decreasing consumer spending, and increased scrutiny over AI's immediate return on investment. In the June quarter, funding for AI infrastructure startups dropped to \$8.4 million from \$74.7 million in the previous quarter. Similarly, AI as a service startups saw the funding decrease to \$8.2 million from \$87.4 million in the March quarter.

Comparing the figures on a year-on-year basis, the funding scenario still reflects a downward trend. AI infrastructure fundingwas \$16.7 million in the June quarter of fiscal 2024, indicating a near 50% reduction. For AI as a service, the decline was even steeper with a drop of 76% against \$35.1 million raised in the year ago period.

Mayuresh Raut, managing partner at Seafund, "The current macro-economic cycle appears to be coming towards its cyclical downward turn. There are several indicators that show consumer spending is decreasing, hiring is slowing down, and the enormous expenses that were thrown at anything AI will have to be tempered." He also said that the hype around AI had outpaced reality, leading investors to demand immediate returns on investment, especially as "there

Wadias book

impairment

of ₹2,000 cr

in Go First

SWARAJ BAGGONKAR

THE WADIA GROUP, erstwhile

promoters of defunct Go Air-

lines (owner of Go First),

booked an impairment charge

of nearly ₹2,000 crore in FY 23

and FY24. About 95% of the

total ₹1,969 crore impairment

charge came in FY23. GoAir

was admitted for insolvency in

its latest annual report, Bom-

bay Burmah Trading Corpora-

tion (BBTC), a Wadia group company which held 48.14%

in the airline, FY24 saw an

impairment charge of ₹103

crore. The year also saw

grounding of the entire fleet of

grounded ever since and

attempts by creditors to sell

the company after inviting

made an investment of ₹290

crore in Go Air in April 2023

through compulsorily convert-

ible preference shares (CCPS).

This was one of the last major

investments made in the

entire group exposure out-

standing as at FY24 has been

fully provided for, based on the

audited financial statements

of the subsidiaries having

exposure in Go Airlines, we

expect no further outstanding

impact on this matter as at end

of FY24," an audit report of the

lenders - Central Bank of India,

Bank of Baroda and IDBI Bank

- invited bids to sell land

parcels aggregating 94.71 acre

in Thane, the reserve price of

which was ₹1,965 crore. Go

Airlines owed ₹3,918 crore to

biggest-ever loss at ₹1,808

crore on a revenue of ₹4,184

crore which was the lowest

FY23 saw Go First record its

In June, Go First's three

"Considering that the

An overseas subsidiary of BBTC, Baymanco Investments,

The fleet has remained

Go First in May, 2023.

bidders have failed.

beleaguered airline.

company stated.


these creditors.

since 2018.

As per disclosures made in

May 2023.

Mumbai, August 19



will be belt tightening across the

Raut further said that the market reality of strong incumbents and the emergence of numerous new players is leading to a shakeout, compounded by growing government oversight and potential new regulations. This combination of factors has made investors more cautious, significantly impacting the availability of capital for AI startups, particularly in services.

On similar lines, Somdutta Singh, an angel investor, said that "geopolitical tensions and rising interest rates have created an unstable investment climate. causing investors to adopt a more cautious approach. Singh also mentioned the saturation of the AI as a service market, where many established players dominate, making it difficult for new entrants to secure funding.

Far-reaching impact on early-stage companies

The reduction in funding has far-reaching implications for early-stage companies in the AI as a service sector. Raut said that while some companies might struggle, those that survive could find it easier to hire talent, raise money, and compete without facing cut-throat competition in the short term.

Singh echoed these sentiments, stating that the funding drought could lead to a higher failure rate among early-stage AI as a service companies. "With less funding available, earlystage companies may need to pivot towards profitability and sustainable business models rather than growth at all costs," she said.

Investors have also raised concerns about the AI as a service market, particularly around data protection, security, and the ethical implications of AI usage. "Every day we are waking up to news about data leaks and algorithms throwing up unaccounted for results," which adds to investor wariness, Raut said. Additionally, Singh said that the high costs associated

with implementing AI technologies, especially for SMEs, remain a significant barrier, further dampening investor enthusiasm.

Potential for broader AI funding landscape

While the funding climate for AI as a service has cooled, the broader AI market has not seen such a dramatic decline. The early stages of generative AI's growth trajectory suggest that there is still significant potential for expansion and mainstream adoption, analysts said.

Singh said that overall investment in AI technologies remains strong, driven by advancements in areas such as GenAI and machine learning. These sectors continue to attract diverse funding sources and higher valuations.

Shiprocket looks to plug Valmo into its platform

ANEES HUSSAIN Bengaluru, August 19

E-COMMERCE ENABLEMENT AGGREGATOR Shiprocket, which is grappling with widening losses, is in talks to integrate Meesho's in-house logistics arm Valmo onto its platform.

This will help the core shipping business which accounts for 70-80% of revenues, but faces margin pressures and increased competition. Saahil Goel, CEO and co-founder of Shiprocket confirms the company is trying to see if Valmo can be plugged into its platform as a supply partner. "Our approach is to bring any and every kind of model onto our platform," he said.

Meesho is currently the largest customer in the thirdparty logistics space, with about 50% market share. The use of Valmo has reduced Meesho's logistics costs by approximately 5%. It is being used to handle 20-22% of Meesho's orders, with expectations to double this capacity in the next 12-18 months.

While Goel claims the core



shipping business has been profitable since 2019, Shiprocket's diversification efforts have come at a cost. Net losses widened from ₹63.6 crore in FY22 to ₹333.8 crore in FY23, despite revenues surging from ₹634.5 crore to ₹1,126.7 crore in the same period. Other expenses more than doubled from ₹503.6 crore to ₹1,104.1 crore. The operating margin deteriorated from -10% to -29.6%, following the cost of diversification.

The results can be partly attributed to Shiprocket's recent acquisitions. In FY22, the company acquired Pickrr and Glaucus Supply Chain Solutions, among others. Pickrr saw its revenue grow from ₹205.8 crore in FY22 to ₹306.5 crore in FY23.

SAAHIL GOEL, CEO AND

CO-FOUNDER, SHIPROCKET

However, its net loss also increased from ₹52.3 crore to ₹105.1 crore during the same period. Glaucus Logistics, another FY22 acquisition, was bought in better financial health, albeit on a smaller scale.

On the company's core value proposition, Goel notes that although price differences of 30-40% exist between courier providers on their platform, volumes are distributed equally.

Air India launches 'BYOD' streaming

ROHIT VAID New Delhi, August 19

IN A BID to offer a premium experience to flyers, Air India has rolled out the 'Bring Your Own Device' content streaming service on select flights, sources told FE.

Passengers on Air India's aircraft will be able to view preloaded content on their own devices. Sources said the service will negate the impact of nonworking in-flight entertainment systems, which has been a major cause of customer complaints. When contacted, the airline did not respond.

The service enables passengers to connect their personally owned devices, such as smartphones, to an onboard computer for the streaming of preloaded entertainment content.

According to sources, the airline has received regulatory approval to roll out the service. In India, IndiGo and Vistara provide such services. Earlier, Jet Airways had a similar product.

Gokaldas defers B'desh apparel unit plan

PRATIK PARIJA

August 19

GOKALDAS EXPORTS HAS decided to put its plan to build garments factory in Bangladesh on hold as the nation continues to face polit-

ical turmoil that has killed

hundreds of people during

weeks-long violence. The Indian company, which

exports to more than 50 countries including the US, Canada and some European nations, will only engage in contract manufacturing in Bangladesh for now, according to Sivaramakrishnan Ganapathi, vice chairman and managing director of the Bengalurubased company.

"We have been watching the economy from a distance

and we were not very sure of making that investment," Ganapathi said in an interview on Bloomberg Television Monday. "We will wait and watch and see how it unfolds. We see a lot more opportunities for us out of India now."

Bangladesh's Prime Minister Sheikh Hasina was forced to step down and flee to neighboring India this month following a series of student-led clashes with pro-government supporters. What started as peaceful demonstrations seeking to abolish a government jobs quota turned into deadly unrest.

More than 600 people have been killed during the weekslong protests, the UN Human Rights Office said in a preliminary report. —BLOOMBERG

MCX(CC)

MULTI COMMODITY EXCHANGE CLEARING CORPORATION LIMITED Regd. Office: Exchange Square, Suren Road, Chakala, Andheri (East), Mumbai - 400093 Email id: ig-mcxccl@mcxccl.com; website: https://www.mcxccl.com; Tel.: +91-22-6864 6000 CIN: U74999MH2008PLC185349

NOTICE OF 16TH ANNUAL GENERAL MEETING (AGM)

Notice is hereby given that the Sixteenth AGM of the Company will be held on Thursday, September 12, 2024 at 4.00 P.M. through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM dated July 26, 2024. Pursuant to the circulars issued by Ministry of Corporate Affairs, AGM will be held through VC/OAVM.

In terms of said circulars, the AGM Notice along with the Annual Report for Financial Year 2023-24 have been sent in electronic mode to all the Members on August 19, 2024 at their email addresses registered with the Company. The AGM Notice is available on the website of the Company at https://www.mcxccl.com/disclosures/announcement and Annual Report is available at https://www.mcxccl.com/disclosures/financial-results. The instructions for attending the AGM are provided in the said AGM Notice.

The documents pertaining to the items of business to be transacted at the AGM shall be available for inspection upto the date of the meeting.

For Multi Commodity Exchange Clearing Corporation Limited

Place: Mumbai Date: August 19, 2024

Mandar Kulkarni Company Secretary





Haq, ek behtar zindagi ka.

Notice For Declaration Of Income Distribution Cum Capital Withdrawal

UTI Aggressive Hybrid Fund (Erstwhile UTI Hybrid Equity Fund)

Name of the Plan	Quantum of IDCW (Gross Distributable Amt.)*		Record Date	Face Value (per unit)	NAV as on August 16, 2024 (per unit)
	%	₹ per unit		**	₹
UTI Aggressive Hybrid Fund Regular Plan - Payout of Income Distribution cum Capital Withdrawal option (IDCW)		7.00% 0.9000	Thursday August 22, 2024	₹10.00	45.5209
UTI Aggressive Hybrid Fund Direct Plan - Payout of Income Distribution cum Capital Withdrawal option (IDCW)	1130000 12000 1200				50.1724

*Distribution of above IDCW is subject to the availability of distributable surplus as on record date. Income distribution cum capital withdrawal payment to the investor will be lower to the extent of statutory lew (if applicable). Income distribution will be made, net of tax deducted at source as applicable.

Pursuant to payment of IDCW, the NAV of the income distribution cum capital withdrawal options of the scheme would fall to the extent of payout and statutory levy (if applicable).

Such of the unitholders under the income distribution cum capital withdrawal options whose names appear in the register of unitholders as at the close of business hours on the record date fixed for each income distribution cum capital withdrawal shall be entitled to receive the income distribution cum capital withdrawal so distributed. The reinvestment, if any, shall be treated as constructive payment of IDCW to the unitholders as also constructive receipt of payment of the amount by the unitholders. No load will be charged on units allotted on reinvestment of IDCW.

Mumbai

August 19, 2024 Toll Free No.: 1800 266 1230 www.utimf.com

REGISTERED OFFICE: UTI Tower, 'Gn' Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051. Phone: 022 - 66786666. UTI Asset Management Company Ltd. (Investment Manager for UTI Mutual Fund) E-mail: invest@uti.co.in, (CIN-L65991MH2002PLC137867).

For more information, please contact the nearest UTI Financial Centre or your AMFI/ NISM certified Mutual Fund Distributor, for a copy of Statement of Additional Information, Scheme Information Document and Key Information Memorandum cum Application Form,

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

GUJARAT GAS LIMITED

Registered Office: Gujarat Gas CNG Station, Sector 5/C, Gandhinagar - 382006, Gujarat Tel: +91-79-26462980 Website: www.gujaratgas.com E-mail Id: Investors@GUJARATGAS.com CIN: L40200GJ2012SGC069118



NOTICE TO THE SHAREHOLDERS FOR THE 12[™] (TWELFTH) ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM). E-MAIL ID/MOBILE NO./BANK MANDATE UPDATION / TDS ON DIVIDEND INCOME AND REQUEST FOR DEMATERIALIZATION OF EQUITY SHARES

1. 12" Annual General Meeting of the Company through VC/OAVM:

NOTICE is hereby given that the 12" (Twelfth) Annual General Meeting ("AGM") of the Shareholders of Gujarat Gas Limited ("the Company") will be held on Thursday, 26" September, 2024 at 3:00 P.M. (IST) through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") facility in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular dated 8" April, 2020, 13" April, 2020, 5" May, 2020, 13" January, 2021, 14" December, 2021, 5" May, 2022, 28" December, 2022 and 25" September, 2023 issued by Ministry of Corporate Affairs ("MCA Circulars") and SEBI Circular dated 12" May, 2020 15" January, 2021, 13" May, 2022, 5" January, 2023 and 7" October, 2023 issued by Securities and Exchange Board of India ("SEBI Circulars") to transact the business that will be set forth in the Notice convening the AGM

The Members can join and participate in the Meeting through VC/OAVM facility only. The instructions for joining the 12" AGM and the manner of participation in the remote electronic voting or casting through the e-voting system during the 12" AGM will be provided in the Notice of the 12" AGM. Members participating in the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

2. Dispatch of Notice of AGM and Annual Report for the Financial Year 2023 – 24 through Electronic mode only:

The Notice of the 12" Annual General Meeting and the Annual Report for the FY 2023-24 including the Financial Statements for the Financial Year ended 31" March, 2024 will be sent to all Members of the Company whose E-mail addresses are registered with the Company's R&TA/Depository Participants in accordance with the MCA Circulars and SEBI Circulars. The Notice of the 12th AGM and the Annual Report will also be available on the website of the Company i.e. www.gujaratgas.com and the website of the Stock Exchanges where the Equity Shares of the Company are listed, i.e. BSE Limited (at www.bseindia.com) and National Stock Exchange of India Limited (at www.nseindia.com) and on the website of Central Depository Services (India Limited (CDSL) (at www.evotingindia.com).

Registration/updation of E-mail IDs/Mobile No./Electronic Bank Mandate and other KYC details:

For Shareholders holding Shares in Physical mode: The Members holding Shares in Physical Form who have not registered or updated their E-mail addresses/Mobile No./Electronic Bank Mandate and other KYC details are requested to submit requisite request forms along with supporting documents to the Company's Registrar & Share Transfer Agent i.e. KFin Technologies Limited either at its Office at KFin Technologies Limited (Unit: Gujarat Gas Limited), Selenium Tower B, Plot No. 31 & 32, Gachibowli, Financial District, Nanakramguda, Serllingampally, Hyderabad Telangana - 500032 or by E-mail with E-Sign to KFintech at einward.ris@kfintech.com. The format or various request forms are available on website of the Company viz. www.gujaratgas.com.

With effect from 1" April, 2024, as per the SEBI Circular dated 10" June, 2024, shareholders holding Shares in physical form and who have not completed any of their KYC details viz. PAN, contact details, bank account details and specimen signature, will be eligible i) to lodge grievance or avail any service request from the R&TA ii) receive dividend, only upon completion of KYC details. Further, SEBI has mandated that with effect from 1" April, 2024 dividend to the physical shareholders shall be paid only through electronic mode.

· For Shareholders holding Shares in Demat mode: The Members holding Shares in Demat Form who have not updated/registered E-mail ID/Mobile/Electronic Bank Mandate and other KYC details are requested to register/update the same along with any other pending KYC updation with their relevant Depository Participant.

Manner of Voting on Resolutions placed before the AGM:

The Company is providing Remote E-voting Facility ("Remote E-voting") to its Shareholders to cast their votes on all resolutions set out in the Notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through E-voting system during the AGM ("E-voting"). The manner of Remote E-voting E-voting for Shareholders holding Shares in dematerialized mode, physical mode and for Shareholders who have not registered their E-mail addresses with the contract of the co be provided in detail in the Notice of the AGM. The details will also be made available on the Company's website www.gujaratgas.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) (at www.evotingindia.com)

5. Dividend, its Record Date, Manner of payment of Dividend, if declared at the AGM and Tax on Dividend Income: Dividend and its Record Date:

The Shareholders may note that the Board of Directors, at its Meeting held on 6" May, 2024, has recommended Dividend of ₹ 5.66/- per Share of ₹ 2/- each (i.e. @ 283%) for the Financial Year ended 31" March, 2024, subject to the approval of the Shareholders at the ensuing AGM.

The Company has fixed Monday, 9th September, 2024 as "Record Date" for determining entitlement of Dividend of ₹ 5.66/- (i.e. 283%) per Share of ₹ 2/each for the Financial Year ended on 31" March, 2024.

Manner of Payment of Dividend, if declared at the AGM:

To avoid delay in receiving Dividend and to receive the Dividend directly into their bank account on the payout date, Shareholders are requested to validate and update their bank account details. Shareholders holding shares in physical form or demat form are requested to update the same by following the process as set out at para 3 above.

Tax on Dividend Income:

The Company vide its separate email communication dated 5" July, 2024, had informed its members regarding the withholding of tax (TDS – Tax Deducted at Source) on Dividend in compliance with the provisions of Income Tax Act, 1961. The said communication also specifies the process to be followed by the members for claiming exemption from deduction of TDS subject to submission of requisite documents / declarations / forms, etc. The said communication can be accessed from Company's Website viz. https://www.gujaratgas.com/investors/tds-on-dividend/. We request you to submit these details and documents as mentioned in the communication on or before 11" September, 2024. No communication on the Tax determination / deduction shall be entertained post the above specified timelines. The Shareholders are requested to upload the Documents/Forms on the upload centre of Company's ['R&TA'] https://ris.kfintech.com/form15/. The forms shall be submitted through the above specified mode only, no other mode shall be accepted.

The above information is being issued for the information and benefit of all the Members of the Company and is in compliance with the MCA Circular/s and

the SEBI Circular/s. Request for dematerialization of Equity Shares:

As per Regulation 40(1) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended read with SEBI Master Circular No.SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated 7th May, 2024, all requests for transfer, transmission and transposition of securities, issue of duplicate share certificates, etc. shall be processed only in dematerialized form. In view of this and to eliminate all risks associated with physical shares, members holding shares in Physical Form are requested to consider converting their holdings to Dematerialized Form. Kindly refer our communication available at www.gujaratgas.com for benefits of holding shares in dematerialized form.

For Gujarat Gas Limited

Place: Ahmedabad Date: 19th August, 2024

Sandeep Dave Company Secretary



GREENCREST FINANCIAL SERVICES LIMITED

CIN: L65921WB1993PLC057785 Regd. Office: 8, Ganesh Chandra Avenue, Saha Court, 1st Floor, Kolkata-700 013

Tel: +91 33 2236 1366, Email: greencrestfin@gmail.com; Website: www.greencrestfin.com

PUBLIC NOTICE FOR PROPOSED VOLUNTARY DELISTING OF EQUITY SHARES FROM THE CALCUITA STOCK EXCHANGE LIMITED Notice is hereby given that pursuant to Regulation 5 and 6 of the Securitie Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2021 (SEBI Delisting Regulations). The Board of Directors of GREENCREST FINANCIAL SERVICES LIMITED (Company) at its meeting held on August 19, 2024 approved inter alia, a proposal for voluntary delisting of Equity Shares from the Calculta Stock Exchange Limited (CSE) only. Presently, the Equity Shares of the Company are listed on both the Exchanges viz.

BSE Limited (BSE) and on the Calcutta Stock Exchange (CSE). Since there has been no trading in the Equity Shares of the Company at the CSE for the last many years and the Company also incurs extra operational costs of being listed on the CSE, therefore, it is being proposed to delist the Equity Shares of the Company from the CSE only. The delisting from CSE will not be prejudicial to or affect the

In terms of Regulation 6 of SEBI Delisting Regulations the Company has proposed the delisting of its Equity Shares from the CSE only without giving any exit opportunity to the equity shareholders of the Company, as the Equity Shares of the Company will remain to be listed on the BSE Limited, having nation wide trading terminal. Subsequently, all the shareholders of the Company shall continue to avail the benefits of listing and trading at the BSE Limited.

For GREENCREST FINANCIAL SERVICES LIMITED

Place: Kolkata Date : August 19, 2024

Sushii Parakh Managing Director

) वैक ऑफ़ बड़ीदा सेंड्स्टर लं. ११, गांधीनगर-३८२०११. વિદ્યાનસભા શાખા : ઘ-૪, ઉદ્યોગ ભવન પાસે, রিক आफ़ বহারে। Bank of Baroda Ph. 079-23226079, Email : vidhan@bankofbaroda.com

કબજાની નોટીસ - સ્થાવર મિલકત માટે

આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા**ના અધિકૃત અધિકારીએ સિક્યુરીટાઈઝેશન એન્ડ रीइन्स्ट्रहशन ओइ हार्छनान्सियल अंसेट्स ॲन्ड ॲनहोर्समेन्ट ऒइ सिड्युरीटी र्एन्टरेस्ट (બીજો) એક્ટ, ૨૦૦૨ અને ક્લમ ૧૩(૧૨) ની મળેલ સત્તાની રૂએ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એનકોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના રૂલ રૂ સાથે વાંચતા તા. ૧૨.૦૬.૨૦૨૪ ના રોજ ડિમાન્ડ નોટીસ આપીને ઉઘારકર્તા મે. ફાર્દીક ગેસ એજન્સી, ૨૩, મેઘ મલ્હાર, પ્લોટ નં. ૧૬, સેક્ટર નં. ૧૧, ગાંધીનગર, ગુજરાત ને નોટીસમાં જણાવેલ બાકી રકમ રૂા. ૭૭,૬૮,૪૨૯.૧૧ (રૂા. સિત્યાતેર લાખ અક્સક હજાર ચારસો ઓગણત્રીસ અને અગિયાર પૈસા) સાથે આજદિન સુધીનું નહીં લગાડેલ વ્યાજ અને અન્ય ખર્ચાઓ સહિતની રકમ આ નોટીસ મળ્યાંના **૬૦ દિવસમાં** પરત ચૂકવવા જણાવ્યું હતું.

આથી ઉદારકર્તા સદર રકમ બેંકને પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉદારકર્તા અને જાહેર જનતાને નોટીસ આપીને જણાવવામાં આવે છે કે આથી નીચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતનો સરફેસી કાયદાની કલમ ૧૩ (૪) અને સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વાંચતા તેઓને મળેલ સત્તાની રૂએ તા. ૧૨.૦૮.૨૦૨૪ ના રોજ **કબજો** લઈ લીધો છે.

આથી ઉદ્યારકર્તા અને જાહેર જનતાને ચેતવણી આપી જણાવવામાં આવે છે કે તેઓ સદર મિલકત અંગે કોઈપણ વ્યવહાર ના કરે અને તેમ છતાં પણ કોઈ તેમ કરશે તો તેઓ બેંક ઓફ બરોડા પાસેથી લીધેલ બાકી રકમ રૂા. ૭૭, ૬૮, ૪૨૯.૧૧ (રૂા. સિત્યાતેર લાખ અડસઠ ફજાર ચારસો ઓગણત્રીસ અને અગિથાર પૈસા) સાથે નક્કી કરેલ દરે તેના ઉપરનું વ્યાજ, રકમ અને અન્ય ખર્ચાઓ વગેરે નાણાંની ચૂકવણી નાં ધાય ત્યાં સુધીની રકમ બેંકને ચૂકવવા સારૂ બંધનકર્તા રહેશે. ઉધારકર્તાઓને ખાસ ધ્યાન દોરવાનું કે સરફેસી કાયદાની કલમ ૧૩(૮) ની જોગવાઈ અનુસાર આપેલ સમયમર્યાદામાં કાયદાનુસાર તેમની સલામત મિલકત પાછી મેળવી શકે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

મુખ્ય બાંઠેઘરી : ન્યાયિક ગીરો મૂકેલ ગેસનું ગોડાઉન, સર્વે નં. ૪૯૨ પૈકી ક્ષેત્રફળ ૯૨૮.00 ચો.મી., મુ. વાવોલ, તાલુકો અને જીક્ષો ગાંઘીનગર ખાતે આવેલ શ્રી કપિલદેવ આઈ. રાવળના નામની મિલકત. જેની આજુબાજુ : પૂર્વમાં સનદમાં દર્શાવ્યા મુજબ, પશ્ચિમમાં સનદમાં દર્શાવ્યા મુજબ, ઉત્તરમાં સનદમાં દર્શાવ્યા મુજબ, દક્ષિણમાં સનદમાં દર્શાવ્યા મુજબ. અધિકૃત અધિકારી, બીઓબી, વિધાનસભા શાખ તા. ૧૯.૦૮.૨૦૨૪ સ્થળ : ગાંઘીનગર

ASHIKA

ASHIKA CREDIT CAPITAL LIMITED

CIN: L67120WB1994PLC062159 Trinity 226/1 A.J.C. Bose Road, 7th Floor, Kolketa-700020

Tel: (033) 40102500; Fax: (033) 40102543 Email: secretarial@ashikagroup.com; Website; www.ashikagroup.con

CORRIGENDUM TO THE NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING

This is with reference to our intimation dated 6th August, 2024 and published on 7th August, 2024 in Regional and English Newspaper (All India Edition) wherein, Ashika Credit Capital Limited ("the Company") had issued Notice dated 31st July, 2024 (EGM Notice) for convening the (01/2024-2025) Extra-Ordinary General Meeting of the Compan which is scheduled to be held on Friday, 30th August, 2024 at 11:30 A.M. through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) to transact the Businesses mentioned in the EGM Notice.

In context of withdrawal of date of closure of Register of Members and Share Transfer Books of the Company, this Corrigendum to the EGM Notice is hereby given to the Shareholders that in page no. 8, point no. 7 to the Notes of Notice of EGM dated 31st July, 2024, as mentioned below, shall stand withdrawn:

7. Pursuant to the provisions of Section 91 of Companies Act 2013 and rules thereon, read with Regulation 42(5) of the Listing Regulations, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, the 23rd Day of August, 2024 to Friday, the 30th Day of August, 2024 (both days inclusive).

Pursuant to the relevant MCA and SEBI Circulars, and the relevan provisions of the Companies Act, 2013 and Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Corrigendum to the Notice of Extra Ordinary General Meeting has been dispatched on Monday, 19th August, 2024 through electronic mode to those Members whose e-mail addresses are registered are registered with the Company/ the Depository Participant(s).

All other information and content as set out in the EGM Notice dated 31st July, 2024 including the resolutions to be considered thereat remain unchanged. Members may note that the Corrigendum to the EGM Notice is available on the Company's website at www.ashikagroup.com at the weblink https://ashikagroup.com/investor_relation_details.php? category=preferential-allotment-of-securities and on the website of the Stock Exchange where the Company's Equity Shares are listed i.e. www.bseindia.com

Accordingly, all the concerned Shareholders, Stock Exchange, Depositories, Registrar and share Transfer Agent, Agencies appointed for e-voting, Other Authorities, Regulators and all other concerned

persons are requested to take note of the aforesaid correction For Ashika Credit Capital Limited

(Anju Mundhra) Date: 19.08.2024 Company Secretary Place : Kolkata FCS: 6686

UNITED CREDIT LIMITED

CIN: L65993WB1970PLC027781 Registered Office: 27B, Camac Street (8th Floor), Kolkata - 700 016.

Telephone No. (033) 2287 - 9359/9360 Email: unitedcredittd@gmail.com, Website: www.unitedcredittd.com

NOTICE is hereby given that the 53" Annual General Meeting (AGM) of the Members of United Credit Limited will be held on Wednesday, the 25" day of September, 2024 at 11:00 A.M.(IST) through Video Conference (VC) / Other Audio Visual Means (DAVM), to transact the business set out at the Notice of the 53" AGM in conformity with General Circular 09/2023 issued by the Ministry of Corporate Affairs (MCA) dated 25" September 2023 and SEBI Circular no SEBI/HO/CFD/CFD-PoD2/P/CIR/2023/167 dated 7" October 2023 (hereinafter collectively referred to as "the Circulars") and all other applicable laws. The Notice of the 53" AGM along with the Annual Report 2023-24 will be sent only through lectronic mode to those Members whose email addresses are registered with th Company or Depository Participant. Members may note that the Notice and Annual Repor for the financial year 2023-24 will also be available on the Company's website www.unitedcredititd.com and on the website of the Stock Exchanges i.e BSE Limited and The Calculta Stock Exchanges Limited at www.bseindia.com and www.cse-india.com. Members can attend the AGM only through VC/OAVM, Members attending the AGM

brough VC/ OAVM shall be counted for the purpose of reckoning the guorum under section 103 of the Act. In compliance with the provisions of the Companies Act, 2013 and isting Regulations, the Company is providing remote e-voting facility ("remote e-voting" to all the members as on the cut-off date of Wednesday, 18" September, 2024 (end of day) o enable them to cast their votes electronically in respect of all business set out in the Notice of the 53" AGM. Accordingly, the company is also providing the facility for e-voting system at the AGM ("e-voting") Members who have not registered their email address will lave an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice o the AGM through remote e-voting or through e-voting system during the AGM. The instructions for remote e-voting joining the AGM and e-voting during the AGM for member holding shares in dematerialized and physical mode will be provided in the Notice of the 53"AGM.

f your email address is already registered with the Company/Depository/RTA, Notice Annual Report and login details for e-voting will be sent to your registered e-mail address n case you have not registered your e-mail address, mobile no., and/or not updated your bank account mandate with the Company/Depository/RTA please follow the below nentioned instructions to register your email for receiving Notice, Annual Report, logir etails for e-voting and join the AGM through VC/OAVM.

Registration/updation of e-mail addresses & bank account details

Physical

Send a request to RTA of the Company i.e CB Management Services Limited, 20, Sir R N Mukherjee Road, Kolkata - 700001 in duly filed Form No. ISR-1, which can be downloaded from the website of the Company at www.unitedcredittd.com as well as RTA's website i.e www.cbmsl.com, You can also send the Form No. ISR-1 to RTA's email id rta@cbmst.com under copy marked to company at unitedcred@td@gmail.com

Please contact your DP and register your email address and bank account details as per the process advised by DP.

In case of any query, Members may contact or write to RTA at address & E-mail ID mentioned above under copy marked to the Company.

For UNITED CREDIT LIMITED

Deepali Gupta COMPANY SECRETARY Place : Kolkata (Membership No. A65652)

DHARANI SUGARS AND CHEMICALS LIMITED

Regd. Office: "PGP House", New Max-59 (OR No.57) Sterling Road.
No.91-64-28311313, Fax No.981-44-28232074, CN - L15421TN1987PLC014454 Email id: secretarial@dharanisugars-pgp.com, Website: www.dharanisugars.id

36th & 37th ANNUAL GENERAL MEETING (AGM), E-VOTING AND BOOK CLOSURE Notice is hereby given that the 36th 6 37th Annual General Mostling (AGM) of the Company will be held on Tuesday, the 10th September 2024 at 11.00 AM 6 3.00 PM respectively (IST) through Video Conference(VC)/Other Audio-Visual Means (OAVM); to transact the business, as set in the notice of AGM, seet to the members by entail. It view of the COVMD-19 parademic, the Ministry of Corporate Affairs (MCA) has vide its circular ness 14/20/20 and 17/20/20 dated April 8, 20/20 and April 13, 20/20. Circular No.20/2020 dated May 5, 2020 and Circular No. 02/2021 dated January 15, 2021 permitte Corcurs No. 2020 dated may 9, 2020 and create No. 1022 of dated sensing 15, 2021 permitted the holding of the Annual General meeting (AGAR) through VC/CAMN, without the physical presence of the members at a common venue. Accordingly, the AGM of the company is also being held through VC to transact the business set out forth in the Notice of the AGM and annual report for the normal content of the AGM and annual report for the financial year 2022-28 & 2023-24 has been sent to all the shareholders whose small addresses

are registered with the Company / Depostory participant(s) in the permitted mode on 16th August 2024. The requirements of sending physical copy of the Notice of the 30th & 37th AGM and the Annual Report to the Momentes have been dispensed with wide MCA and SEE Circular Shareholders holding shares in demakrishized mode are requested in register their email addresses and mobile annual beyond the company of the sending shareholders are requested to register their email addresses and mobile annual beyond the company of the sending shareholders are senting to the sending shares in demakrishized mode are requested to register their email addresses and mobile annual shareholders are senting to the sending shareholders are senting to the senting shareholders and shareholders are senting to the senting shareholders and shareholders are senting to the senting shareholders and shareholders are senting to the senting shareholders are senting to the senting shareholders and shareholders are senting to the senting shareholders are senting to the senting shareholders and shareholders are senting to the senting shareholders are senting shareholders. numbers by clicking the https://investor.cameoindia.com with the Company's Register and Shan Transfer Agent, Cameo Corporate Services Limbrd or email to investor@cameoindia.com

Pursuant to Section 108 of the Companies Act 2013 and Rule 20 of the Companies (Managemen and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclessor Requirements) Regulations 2015, the Company is providing remote e-voting facility (remote e-voting to all its members to cast their votes on all resolutions set out in the Rotice of ADM, Additionally, the ompany is providing the facility of voting through n-voting platform provided by COSL during the AGM) (E-Voting). Detailed procedure foe remote e-voting/e-voting is provided in the Notice of AGM

Members are informed that:
The cut-off date for the purpose of remote e-voting or at the AGM is 3rd September 2024.
The remote e-voting shall commence on 07.09.2024 at 9.00 AM and shall end on 09.09.2024 at

5.00 PM after which e-voting platform shall be disabled by CDSL Those members, who shall be present in the AGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barried from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

d Members who have cast their vote by semide e-voting prior to the AGM may also aftend / participate in the AGM through NC/DAVM but shall not be entitled to cast their vote again. E Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares of the cut-off date; may obtain

the login ID and passworth by sending a request to investors@cameoindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting then he/she can use his/her existing user id and password for casting their votes.

Members holding shares in physical mode and who have not updated their e-mail abdresses with the
Company can obtain Notice of the AGM. Armual Report and/or login details for joining the AGM.

through VCDWMM facility including e-voting be sending scanned copy of (a) Copy of the signed request lettermentioning the folio number, name & address of the Member, (b) Self-attested copy of PAM card and (c) self-attested copy of any documents (e.g., Aadher, Driving Ucense, Election identity, Card, Passport in support of the address of the Member by email to invester@cameaindia.com Members who would like to express their views/ask questions as a speaker at the meeting may or

Interiors who would see to express their verwijzes questions as a speaker at the meeting may preregister themselves by sending a request from registered e-mail address merdioning their names, DPID,
Client (DPridix Rumber, PAN) and mobile number to secretarials@theranisegare-pgs.com 7 (servin)
days prior to meeting. Only those members who have pre-registered themselves as speakers will be
allowed to express their views/ask questions during the AGM. The company reserves the right to restrict
the number of speakers depending on the availability of time for the AGM.
The Board of Directors to the Company has appointed Mr. M Damodaran. Practicing Company
Sacretaries, Chemia as the scrutinizer to scrutinize the e-voting process and voting of the AGM in a
fair and transcener transcent. The insults declared abone with the Scrutinizer's month shall be

fair and transparent manner. The results declared along with the Scrutinizer's report shall be communicated to the stock exchange and will also be displayed on the Company website www.dharanisugars.com within 48 hours from the conclusion of AGM.

The notice of the 36th & 37th AGM and Annual Report for the financial year 2022-23 & 2023-24 will

also be made available on the Company's website at www.dharanisugars.com. stock exchan website to www.beeinfla.com, www.nseindla.com and CDSL's website at www.eveling.com In case of any queries relating to e-voting, members may refer the Frequently Asked Question

(FAQs) and e-voting manual available at www.evotingindia.com under help section or estall t helipdesk.evolling@cdslindia.com Any grisvance relating to e-voting facility, members may contact Mr P. Nuralidharan, Manager, Cameo Corporate Services Limited, Subramaniam Building No.1 Clab House Road, Chemia -600002. Fel 944-28469390 or email: invester@cameoindia.com. n.Pursusent to Section 91 of the Companies Act 2013 read with applicable Rules and Regulations 42 of

the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Register Members and Share Transfer Books of the Company will remain closed from 04th September 202 to 10th September 2024 (both days inclusive). For Dharani Sugars and Chemicals Limited

Date: 20.08.2024

By order of the Board



આઇડીબીઆઇ બેંક લિ., એતપીએ મેતેજમેન્ટ સુપ, આઈડીબીઆઈ કોમ્પલેલ, મ્યુ. સ્ટાફ ક્વાર્ટસની સાથે, લાલ બંગલોની પાસે, ઓફ સી.જ. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૬, कोल लं. ०३६ - ६६०३२६५३.

સ્થાવર મિલકતોના વેચાણ માટેની **જાહેર સુચ**ના पविशिष्ट-४-ओ (लिशम ६(९) जो फोअवार्ड पुरुते)

સિક્યુરીટાઈગેરાન એન્ડ રીકનસ્ટુકરાન ઓફ ફાઈનાલ્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ના નિયમ ૯(૧) ની જોગવાઈ અંતર્ગત સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ - ૨૦૦૨ હેઠળ બેંકમાં ગિરવે મુકેલ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ.

આથી જાહેર જાહેર જનતાને અને નીચે જણાવેલ ઉપારકર્તાઓ, જામીનદારો અને મોર્ગેજરોને નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલી સ્થાવર મિલકર્તો જે બેંકના મોર્ગેજ / ચાર્જ માં મુકેલ છે. આઈડીબીઆઈ બેંક લિ તા અધિકૃત અધિકારીશ્રીએ નીચે આપેલ મિલકતોનો કબજો લઈ લીધેલ છે. બેંકનાં ભાકી નીકળતાં નાણાં વસૂલ કરવા માટે મિલકતોનું "જે છે જયાં છે જેમ છે અને જે કાંઈ છે" ના યોરણે તા. ૦૫.૦૬.૨૦૨૪ ના રોજ વેચાણ કરવામાં આવશે. અનામત કિંમત અને અર્નેસ્ટ મની ડીપોઝીટ નીચે મુજબ રહેશે.

5H of.	ઇદારકર્તાનું નામ	भासिङ छले भोर्गेषश्नुं नाम	કીમાન્ડ નોટીસની તારીખ કુલ બાકી વ્હેંણી રકમ	મિલકતોનું વર્ણન	અનામત કિંમત ઇસ્ત્રેમડી	સંબંધિત અધિકારીની સંપર્ક વિગતો
€. 8	ઓમ રમેશથંદ્ર શ્રી નાગરાજ ગણપતરામ જીલેંગ ફેક્ટરી મિસ્ત્રી		39,04,2093 	રહેલાં ક પ્લોટનું ક્ષેત્રફળ ૮૧૪.૭૭ સ્કે.મી., સંયુક્ત સીટી સર્વે નં. ૨૮૦૦ ધૈકી, શીટ નં. ૮૩, રેવન્યુ નં. ૭૨૨/પી૧ ધૈકી, જે સ્થિત હારીજ, ચ્યુનિસીપલ એરીયા, ગાયત્રીનગર થી જાલીતો એરીયા, તાલુકો - હારીજ, પાટલ, ગુજરાત.		શ્રીયતી નિધી સકશેના, (ટેલિ) : ૦૭૯ - ૧૬૦૭૨૭૧૦, ઈમેલ : nidhi sn@idbi.co.i અને શ્રી ભાવિન કમોડી, (મો) : ૯૯૦૯૮૮૩૩૩, ઈમેલ: bhavin_kamothi@idbi.co.in
				પ્લોટ નં. ૧૭૧	31. 4,26,300/-	
					₹I. 42,630/-	
				પ્લોટનં. ૧૮૫	₹I. 4,₹€,300/-	
					31. 42,630/-	
				પ્લોટનં. ૩૨૮	₹L 4, ₹6,300/-	
					31. 42,630/-	
				પ્લોટનં. ૩૨૯	₹I. 4, ₹6,300/-	
					₹I. 42,630/-	
				પ્લોટ નં. ૩૩૭	31. 4,26,300/-	
					₹L 42,630/-	
				પ્લોટ નં. ૩૩૮	31. 4,26,300/-	
					31. 92,630/-	
				પ્લોટ નં. પલ	31. 4,26,300/-	
				W. P. C. Harvey	₹L 42,630/-	
				પ્લોટનં, ૧૨૯	3L 4,26,300/-	
				F83.22905-353	\$I. 42,630/-	
			1	પ્લોટનં, ૧૭૭	21. 4,26,300/-	
					\$L 42,630/-	
				પ્લોટ નં. ૩૧૯	31. 4, 26, 300/-	
					31. 42,630/-	
				પ્લોટ નં. ૩૩૧	\$1. 4,20,300/- \$1. 42,630/-	
				રહેલાંક ઘરનું ક્ષેત્રકળ ૧૧૨.૦૧ સ્કે.મી. પૈકી પૂર્વ	ğı, 44,630/-	શીમતી નિધી સક્સેના, (ટેલિ) : ૦૦૯ -
2.	ઓમ શ્રી નાગરાજ રમેશચંદ્ર શ્રુનિંગ મસ્ત્રી ફેક્ટરી મિસ્ત્રી		રમેશસંદ ૩૧.૦૫.૨૦૧૩ ગણપતરામ	ખાજુની જમીનનું ક્ષેત્રકળ ૮૨.૭૩.૧૦, સીટી સર્વે નં. ૮૬૩, સીટ નં. ૫૪, ચલતા નં. ૧૪૪, જે સ્થિત	31. 4,35,000/- 31. 44,000/-	લામના ાનવા નાકવના, (દાવ): ૦૦૯- ૬૯૦૩૨૦૧૦, ઈમેલ: nidhi,sri@idbi.co.in અને શ્રી ભ્રાલિન કર્યારી, (મો): ૯૯૦૯૮૮૩૩૩, ઈપેલ: bhavin_kamothi@idbi.co.in
					Casa details	
3.	ઓમ શ્રી તાગરાજ	રમેશચંદ્ર ગણપતરામ	31,04,2013	ગોડાઉનનું લેગફળ ૧૬૭.૭૫ સ્કે.મી., પ્લોટ નં ૨૭/બી, પ્લોટ નં. ૨૭/સી. સંયુક્ત રેવન્યુ સર્વે નં. ૪૨૯ પૈકી, જે સ્થિત હારીજ, મ્યુનિપલ હદદમાં	\$1. 44,04,000/-	શ્રીમતી નિધી સક્સેના, (ટેલિ) : oac - ૧૯૦૩૨૭૧૦, ઈમેલ : nidhi.sn@idbi.co.in અને શ્રી ભાવિત કમોડી,
	છુલિંગ કેક્ટરી	મિસ્ત્રી	31. 43,38,30,963/-	આવેલ, તાલુકો - હારીજ, જીલ્લો - પાટણ,	\$1. 4,40,000/-	(Hi): ecoeccca333,
-	7855B	શ્રી પંકજકુમાર		ગુજરાત. તમામ ભાગ અને હિસ્સા સાથેની સ્થાવર મિલકતને		ઈમેલઃ bhavin_kamothi@idbi.co.in શ્રીમની વિધી સકસેવા, (ટેલિ): ૦૭૯ -
	vev	સુરેશભાઇ સોની સુરેશભાઇ સોની	04.03.2093	તમામ ભાગ અંગ હિસ્સા સાથવા સ્થાવરા મળકતવું ક્ષેત્રફળ ૩૩૭-૭૫ સ્કે.મી. સંયુક્ત રેવન્યુ સર્વે નં.	31. 3,20,000/-	સામતા ાવવા સકસવા, (ટાલ): ૦૭૯ - ૧૯૦૩૨૭૧૦, ઈમેલ: nidhi.sni@idbi.co.in
¥.	msfe	अने श्रीभती		શ્લ, પ્લોટ નં. રકથી રલ, જે સ્થિત ગામ -	31. 34,000/-	અને શ્રી ભાવિત કમોઠી,
	ਰੰ•ਤਵਟ੍ਰੀਸ	ગૌરીબેન ચીમનવાલ સોની	₹L c,eu,se,3cs/-	દાંતરવાડા, તાલુકો - હારીજ, જીલ્લો - પાટલ, ગુજરાત.	41. 34,000/2	(મો) : ૯૯૦૯૮૮૮૩૩૩, ઈમેલઃ bhavin_kamothi@idbi.co.in
	એ કાંતિભાઈ			ટેનામેન્ટ નં. ૨૦, અયોધ્યાપુરી સોસાયટી, પાર્ચ		A viPer em CIPA
7 - 7 - 122-35 - 103	[,]	જસમતભાઈ દલસાણીયા		એચપી ગેટ એજન્સી ની પાર્સ, સર્વે નં. ૩૮૦/૨,		ગ્રી સંદિપ દાસ, (ટેલિ): ૦૦૦ - ૧૧૦૦ ર૧૪૧, ઈમેલ: d.sandip@idbi.co.in અને
	100000000000000000000000000000000000000	भ. इत्तर्वनेटीक देशभाई प्रसम्तवार्ध	26.05.5040	રૂપળ સરહવ રોડ, તાલુકો - ગાંધીનગર, જીલ્લો - ગાંધીનગર, પીન - ૩૮૨૪૪૦, પ્લોટ એરીયાનું	31. 1,31,000/-	શ્રી વિકાસ ચતુરવેદી. (ટેલિ) : ૦૦૯ - ૮૯૦૭૨૭૪૫, ઈમેલ: vikas chaturyedi@idbi co.in.
	કાઇનટાક કેમિકલ્સ		31. x,4c,56,8xc/-	શેત્રફળ ૧૦૦.૩૩ સ્કે.મી. અને બાંધકામના		
	દલસાશીયા (ભાગીદાર) શ્રીમતી મેથા નિતીન જેવી (મોર્ગેજર)			એરીયાનું ક્ષેત્રફળ ૧૩.૧૦ સ્કે.મી.		o we was consulved (grass co.ii).
		,,		બીન ખેતીલાયક જમીન અને બિલ્ડીંગની જગ્યાનું		શ્રી સંદિપ દાસ, (ટેલિ): ૦૭૯ - ૧૧૦ ૭૨૧૧૧, ઈમેલ: d.sandip@idbi.co.in અને શ્રી પ્રજ્ઞાત વર્ષા.
	ુમે. શ્રી	મે. શ્રી શિવશક્તિ	05,03,2043	શેત્રફળ ૯૭૧૨ સ્કે.મી., બિલ્ટ અપ એરીયાનું	31. 4,3c,8c,000/-	
	शिवशकित र्ग-दर्भाव			ક્ષેત્રકળ ૧૯૬૫. ૬૯ સ્કે. મી., જેસ્થિત રેવન્યુસર્વે નં. ૩૪૭/પી, એકર ૨-૧૬ ગુંઠાસ, રાધનપુર		
ş.	र्थन्डस्ट्रीय (भागीदारी	ಕೇತಕ್ಷನಿಗ	31. 43,44,44,454/-	ના હરું આ, અંકર ર-૧૨ નુકાસ, રાવનપુર સીટી, રાધનપુર - પાલવપુર હાઈવે, ગામ -	3L 43,64,000/-	व्याप्रसास चर्चा, (टेबि) : ०७४ - ६६०७२७२८,
	પૈકી)	(ભાગીદારી પેઢી)		સિનાદ, તાલુકો - રાયનપુર, જીલ્લો - પાટણ,	CONTRACTOR	र्छभेषः prashant.verma@idbi.co.in
	1.700			ગુજરાત.		

• **નિરીકાલની તારીખ**: તા. ૨૦.૦૮.૨૦૨૪, સવારે ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા સુપી ● ઈએમડી સાથે બીડ મોહલવાની છેલ્લી તારીખ : ૦૪.૦૯.૨૦૨૪ ના રોજ સાંજે ના ૪.૦૦ વાગ્યા સુધી.

ઇ-ઢરાજીની તારીખ : ૦૯.૦૫.૨૦૨૪ના રોજ સવારે૧૧.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુપી (પ મિનિટના વિશેષ વધારા સાથે)

વેચાલના વિગતવાર નિયમો અને શસ્તો માટે, કૃષા કરીને https://www.bankeauctionwizard.com અને આઈડીબીઆઈ બેંકની વેબસાઈટ એટલે કે www.idbibank.in માં આપેલી લિકનો સંદર્ભ લો. ઈ-હરાજી સપોટ માટે, કૃપા કરીને સંપર્ક કરો : એન્ટારેસ સિસ્ટમ્સ લિમીટેક, ઢેલિ. હેલ્ય લાઈન નં. ૦૮૦-૪૫૯૮૧૧૦૦, શુમારી બી.એમ. સુપ્તિમા / પ્રવેશ મણી ત્રિપાઠી, ફોન નં. +६९ ८६५९६४४३८३ / ६०४४३९४४६२, द्वेल्प लार्डन र्वमेल समेल स्थार्डडी : sushmitha.b@antaressystems.com / praveshmani.t@antaressystems.com


સિકચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ ના નિયમ ૯(૧) ઢેઠળ વૈદ્યાનિક ૧૫ દિવસની સૂચના ઉધારકર્તા/ જામીનદારો / મોર્ગેજરને આવી ઉપરોક્ત મુજબની રકમ તરાજ પહેલા અપ ટુ ડેટ વ્યાજ અને આનુપાંગિક ખર્ચા સાથે ચુકવવા માટે સૂચિત કરવામાં આવે છે, જો તે નિષ્ફળ જશે તો મિલકતની તરાજ / વેચાણ

કરવામાં આવશે અને બાકી લેશાં જો કોઈ હોય તો વ્યાજ અને કિંમત સાથે વસલ કરવામાં આવશે.

तारीण : २०.०८.२०२४

અધિકૃત અધિકારી આવંડીબીઆવં બેંક લિમિટેડ

ગુજરાત ગેસ લિમિટેડ





વિડીયો કોન્ફરન્સિંગ વિસી/અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) મારફતે ૧૨મી(બાર મી) વાર્ષિક સાધારણ સભા, ઇ-મેઇલ આઇડી, બેન્ક મેન્ડેટ, મોબાઇલ નંબર અપડેશન ડિવીડન્ડની આવક પર ટીડીએસ બાબતની શેરધારકોને સૂચના (નોટિસ) અને ઇક્વિટી શેર્સ / ડિમટીરીચલાઇઝેશન માટે વિનંતી.

૧. કંપનીની ૧૨મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.) વિસી/ઓએવીએમના માધ્યમથી ચોજાશે :

આ સાથે સૂચના આપવામાં આવે છે કે કંપનીના શેરધારકોની ૧૨મી વાર્ષિક સાધારણ સભા **ગુરુવાર, ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૦૩:૦૦ વાગે** વિડીયો કોન્ફરન્સિંગ (વીસી)/અન્ય ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) સુવિધા મારકતે કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની લાગુ પડે તેવી જોગવાઈઓ અને તેને અંતર્ગત બનાવાયેલા નિયમોને આધીન તથા સેબી (લિસ્ટિંગના બંધનકારક કરાર અને ડિસ્કલોઝરની આવશ્યકતા) ૨૦૧૫ને મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેસં (એમસીએ)ના પરિપત્ર દ્વારા ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ ૨૦૨૦, ૫ મે, ૨૦૨૦, ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, ૧૪ કિસેમ્બર, ૨૦૨૧, ૫ મે, ૨૦૨૨, ૨૮ ડીસેમ્બર, ૨૦૨૨ અને ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવેલા સામાન્ય પરિપત્ર (એમસીએ પરિપત્રો) તથા સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા તા.૧૨ મે, ૨૦૨૦, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧, ૧૩ મે, ૨૦૨૨, પ જાન્યુઆરી, ૨૦૨૩ અને ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ના પરિપત્ર (સેબી સરક્યુલર) સાથે વાંચવામાં આવતા નિયમો મુજબ એજીએમ ની નોટિસમાં નક્કી કરેલ બિઝનેસ ચલાવવાના આશયથી બોલાવવામાં આવી છે.

સભ્યો માત્ર વિડીયો કોન્કરન્સિંગ (વીસી)/અન્ય ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) સુવિધા મારકત જ મીટીંગ માં જોડા ઇને ભાગ લઇ શકશે. ૧૨મી એજીએમ માં અને રિમોટ ઇ-વોર્ટિંગમાં ભાગ લેવાની અથવા ૧૨મી એજીએમ દરમ્યાન ઇ-વોર્ટિંગ પધ્ધતિથી પોતાનો મત આપવાની રીત ૧૨મી એજીએમ ની નોટિસમાં જણાવવામાં આવશે. કંપની કાયદો, ૨૦૧૩ની કલમ ૧૦૩ મુજબ વીસી/ઓએવીએમ દ્વારા એજીએમ માં ભાગ લેનાર સભ્યોની ગણતરી, કોરમ પુરૂ કરવા માટે જરૂરી, હાજર સભ્યોની સંખ્યાની ગણતરીમા થશે.

વાર્ષિક સાધારણ સભા(એજીએમ)ની નોટિસ અને નાણાંકિય વર્ષ ૨૦૨૩-૨૪નો વાર્ષિક અહેવાલ માત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ મોકલવા બાબતે :

એમસીએ અને સેબી ના પરિપત્રો ની જોગવાઈનું પાલન કરીને જે શેરધારકોનાં ઈ-મેઇલ એડ્રેસ આર એન્ડ ટીએ / ડીપોઝીટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાયેલા છે તેઓને ૧૨મી (બારમી) વાર્ષિક સાધારણ સભાની નોટિસ અને નાણાંકિય વર્ષ ૩૧મી માર્ચ, ૨૦૨૪ અંત નાં નાણાંકિય સ્ટેટમેન્ટ્સ તેમજ નાણાંકિય વર્ષ ૨૦૨૩-૨૪નો વાર્ષિક અહેવાલ મોકલવામાં આવશે. કંપનીના વાર્ષિક અહેવાલ અને ૧૨મી એજીએમ ની નોટિસ કંપનીની વેખસાઇટ www.gujaratgas.com પર અને કંપનીના શેર્સ લિસ્ટેડ છે તે સ્ટોક એક્ષચેન્જસની વેબસાઇટ એટલે કે બીએસઈ લિમીટેડ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com અને સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વીસીસ (ઇન્ડિયા) લિમીટેડ (સીડીએસએલ)ની વેબસાઈટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

ઈ-મેઈલ આઈડી/મોબાઇલ નંબર/ ઇલેક્ટ્રોનિક બેન્ક મેન્ડેટ અને અન્થકે.વાય.સી.ની વિગતો નોંધાવવાની / અપડેટ કરાવવાની રીત :

- **ફીઝીકલ મોડમાં શેર ઘરાવતા શેરઘારકો માટે** : જે સભ્યો ફીઝીકલ મોડમાં શેર ધરાવે છે અને તેમનાં ઈ-મેઈલ એડ્રેસ / મોબાઈલ નંબર/ ઇલેક્ટ્રોનિક બેન્ક મેન્ડેટ અને અન્ય કે.વાય.સી.ની વિગતો નોધાવી કે અપડેટ કરાવી નથી તેઓએ કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સકર એજન્ટ એટલે કે કેફીન ટેકનોલોજીસ લિમિટેડ ને તેમની ઓફિસ (યુનિટ : ગુજરાત ગેસ લિમિટેડ), કેકીન ટેકનોલોજીસ લિમિટેડ, સેલેનિયમ ટાવર, પ્લોટ નંબર ૩૧ અને ૩૨, ગચીબોવલી, ફાઈનાનન્સિયલ ડિસ્ટ્રિકટ, નાનકરામગુડા, સેલિંગમપલ્લી, હૈદરાબાદ, તેલંગણા-૫૦૦૦૩૨ ખાતેની તેની ઓફિસમાં સહાયક દસ્તાવેજો સાથે જરૂરી વિનંતી કોર્મ મોકલી આપવા વિનંતી છે અથવા ઇ-સાઇન સાથે ઇ-મેઇલ દ્વારા કેફીનટેક ને <u>einward.ris@kfintech.com</u> પર મોકલી આપવા વિનંતી છે. ફોર્મેટ અથવા વિવિધ વિનંતી ફોર્મ કંપનીની વેબસાઇટ એટલે કે www.gujaratgas.com પર ઉપલબ્ધ છે.
- ૧૦મી જુન, ૨૦૨૪ના સેબી ના પરિપત્ર મુજબ ૦૧લી એપ્રિલ, ૨૦૨૪થી પ્રભાવિત, ફીઝીકલ સ્વરૂપમાં શેર ધરાવનારા શેરધારકો અને જેમણે તેમની કે.વાય.સી વિગતો જેવી કે પાન, સંપર્ક વિગતો, બેંક ખાતાની વિગતો અને નમુનાની સહીની વિગતો અપડેટ કરવાની પ્રક્રિયા પુર્ણ કરેલ નથી તેઓ (૧) ફરિયાદ નોંધાવવા અથવા આરએનટીએ તરફથી કોઇપણ સેવા વિનંતીનો લાભ લેવા માટે (૨) ડિવિડન્ડ મેળવવા માટે કે.વાય.સી વિગતો પૂર્ણ થયા પછી જ લાયક રહેશે. તદ્દપરાંત, સેબીએ ૧ લી એપ્રિલ, ૨૦૨૪ થી ફિઝીકલ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને ડિવિન્ડ ફરજીયાત ઇલેક્ટ્રોનિક મોડમાં આપવાનો નિર્ણય કર્યો છે.
- **ક્રિમેટ મોડમાં શેર ધરાવતા શેરધારકો માટે** : ક્રિમેટ મોડમાં શેર ધરાવતા શેરધારકો કે જેમણે તેમનાં ઈ-મેઈલ એડ્રેસ / મોબાઈલ નંબર/ ઇલેક્ટ્રોનિક બેન્ક મેન્ડેટ અને અન્ય કે.વાય.સી.ની વિગતો નોધાવી કે અપડેટ કરાવી નથી તેઓને તેમના ડિપોઝીટ પાર્ટિસિયન્ટ પાસે કોઇપણ બાકી કે.વાય.સી. નોધણી/અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે.

એજીએમ માં પ્રસ્તાવમા મુકાયેલ ઠરાવો પર મતદાન કરવાની રીત :

કંપની તેનાં સબ્યોને એજીએમમાં પ્રસ્તાવમા મુકાયેલ ઠરાવો પસાર કરવા માટે તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઈલેક્ટ્રોનિક માધ્યમથી રિમોટ ઈ-વોટિંગ (''રિમોટ ઈ-વોટીંગ")ની સવલત પુરી પાડશે. આ ઉપરાંત એજીએમ દરમ્યાન પણ ઈલેક્ટ્રોનીક માધ્યમ દ્વારા (ઈ-વોટીંગ) કરવાની સવલત પુરી પાડશે. જે સબ્યો ડેમટીરલાઇઝ્ડ મોડ, ફિઝીકલ મોડ માં શેર ધરાવતા હોય અને જે સભ્યોએ તેમનું ઇ-મેઇલ સરનામુ નોંધાવ્યું નથી તેઓને રિમોટ ઇ-વોટીગ / ઇ-વોટીગ મારફત મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા એજીએમ ની નોટિસમાં આપવામાં આવશે. આ ઉપરાંત કંપનીની વેબસાઇટ <u>www.gujaratgas.com</u> અને સેન્ટ્રલ ડીપોઝીટરી સિક્યુરીટીઝ (ઇન્ડિયા) લિમીટેડ (સીડીએસએલ) ની વેબસાઇટ પર <u>www.evotingindia.com</u> પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડીવીડન્ડ, તેની રેકોર્ડ તારીખ, એજીએમ વખતે જો ડીવીડન્ડ જાહેર કરવામાં આવે તો ડીવીડન્ડ ચૂકવણીની રીત અને ડીવીડન્ડની આવક પર વેરો : ડીવીડન્ડ અને તેની રેકોર્ડ તારીખ :

કંપની એ તા. કહી મે, ૨૦૨૪ ના રોજ યોજાયેલ કંપની નાં બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગમાં ૩૧મી માર્ચ, ૨૦૨૪ના રોજ પુરા થતા નાણાંકિય વર્ષ માટે ₹ ૨.૦૦ના એક એવા પ્રતિ શેર દીઠ રૂ. પ. ૬૬ (એટલે કે ૨૮૩%) ડીવીડન્ડની,આગામી એજીએમમાં શેરધારકોની મંજુરીની અપેક્ષાએ, ભલામણ કરેલ છે. કંપની એ, ૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ પુરા થતા નાણાંકિય વર્ષ માટે પ્રતિ શેર દીઠ ₹ પ.૬૬ (એટલે કે ૨૮૩%) ડીવીડન્ડનાં અધિકાર માટે **સોમવાર, ૯ સપ્ટેમ્બર, ૨૦૨૪** ને

"રેકોર્ડ ડેટ" તરીકે નક્કી કરેલ છે. એજીએમ વખતે કીવીકન્ક જાહેર કરવામાં આવે તો કીવીકન્ડ ચુકવણીની રીત :

૧૨મી એજીએમમાં જો શેરધારકો દ્વારા ડીવીડન્ડ મંજુર કરવામાં આવેતો જે શેરધારકોએ તેમની બેંકની માહિત અપડેટ કરેલ છે તેઓને ઈલેકટ્રોનીક મોડ મારફતે ચુકવાશે. ડીવીડન્ડ મેળવવામાં વિલંબ ટાળવા અને ચુકવણીની તારીખે જ પોતાનાં બેંક ખાતામાં મેળવવા માટે ઉપરનાં ફકરા ૩માં દર્શાવેલ પ્રક્રિયા અનુસરીને પોતાની બેંકની માહિતી અપડેટ કરવા ફીઝીકલ ફોર્મ/ડીમેટ ફોર્મમાં ધરાવતા શેરધારકોને વિનંતી કરવામાં આવે છે.

ડિવિડન્ડની આવક પર વેરો

કંપનીએ ૦૫મી જુલાઈ, ૨૦૨૪ના રોજ તેના અલગ ઇમેલ કમ્યુનિકેશન દ્વારા તેના સભ્યોને આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની જોગવાઈઓનું પાલન કરીને ડીવીડન્ડ પર વેરો કપાત (ટીડીએસ-સ્ત્રોત પર વેરો કપાત) અંગે જાણ કરી હતી. આ પત્ર વ્યવહાર સભ્ય એ ટીડીએસ કાપવામાં મુક્તિ મેળવવાના જરૂરી દસ્તાવેજો / ડિક્લેરેશન ફોર્મ જમા કરવવા વિગેરે બાબતે પણ જાણકારી આપી છે. આ કમ્યુનિકેશન કંપનીની વેબસાઇટ https://www.gujaratgas.com/investors/tds-on-dividend/ પરથી મળી શકશે. અમે આપને, કમ્યુનિકેશનમાં ઉલ્લેખિત વિગતો અને દસ્તાવેજો **તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪**ના રોજ અથવા તે પહેલાં જમા કરવા, વિનંતી કરીએ છીએ. ઉપરોક્ત ઉલ્લેખિત સમયમયાંદા પછી વેરો નિર્ધારણ/કપાત પર કોઈ સંદેશાવ્યવહાર ધ્યાને લેવામાં/કરવામાં આવશે નહીં. શેરધારકોને કંપનીના [આર&ટીએ] <u>https://ris.kfintech.com/form15/</u>ના અપલોડ સેન્ટર પર દસ્તાવેજો / કોર્મ અપલોડ કરવા વિનંતી કરવામાં આવે છે. ફોર્મ ફક્ત ઉપરોક્ત ઉલ્લેખિત માધ્યમ દ્વારા જ જમા કરવા, અન્ય કોઇ માધ્યમ દ્વારા સ્વીકારવામાં આવશે નહી. ઉપરોક્ત માહિતી કંપનીના તમામ સભ્યોની માહિતી અને લાભ માટે જારી કરવામાં આવી રહી છે અને તે એમસીએ પરિપત્રો / સેબીના પરિપત્ર (ઓ)નું પાલન કરે છે.

ઇક્વિટી શેરના ડિમટીફિયલાઇગેશન માટેની વિનંતી :

સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર જરૂરિયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના નિયમન ૪૦(૧) મુજબ અને સેબી માસ્ટર પરિપત્ર નં.SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 તારીખ ૦૭મી મે, ૨૦૨૪ ને વેચાળમાં લઘ સિક્યોરિટીઝના ટ્રાન્સફર, ટ્રાન્સેમશન અને ટ્રાન્સપોઝિશન, ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ ઇશ્યુ કરવા, વગેરેની પ્રક્રિયા માત્ર ડિમટીરીયલાઇઝુડ સ્વરૂપમાં જ કરવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને અને ફિઝીકલ શેરો સાથે સંકળાયેલા તમામ જોખમોને દૂર કરવા માટે, ફિઝીકલ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ફીઝીકલ શેસં ડિમટીરીયલાઇઝ્ડ સ્વરૂપમાં તબદીલ કરાવે. આ અંગેનો પત્ર વ્યવહાર ડીમીટરીયાલાઈઝડ ફોર્મમાં શેસં રાખવાના ફાયદા અંગે અમારી <u>www.gujaratgas.com</u> વેબસાઈટ પર પણ જોઈ શકો છો.

ગુજરાત ગેસ લિમિટેડ વતી

સહી/-સંદીપ દવે કંપની સેક્ટરી

આળ:અમદાવાદ તારીખઃ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૪